

ત્વરિત જાહેરાત માટે

બ્રમ્પટન સીટી કાઉન્સિલે રહેવાસીઓ, ધંધાઓ અને સમુદાય સમૂહોને સહાયરૂપ થવા યુઝર ફીમાં ફેરફારો મંજૂર કર્યા

બ્રમ્પટન, ઓન્ટેરિયો (મે 29, 2020) – આ અઠવાડિયે, બ્રમ્પટન સીટી કાઉન્સિલે પોતાના યુઝર ફી બાય-લોમાં ફેરફારોને મંજૂરી આપી જેથી સમુદાય પર COVID-19 થી થયેલા નાણાકીય પ્રભાવો ઘટાડવામાં મદદ મળી શકે.

બુધવારે પોતાની બેઠકમાં, કાઉન્સિલે રિક્વિઝિશન, પરફોર્મિંગ આર્ટ્સ, ફેસિલિટી સર્વિસીસ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, લેજીસ્લેટિવ સર્વિસીસ, તેમજ પાર્ક્સ અને ફોરેસ્ટરીના ક્ષેત્રોમાં નોંધપાત્ર સંખ્યાબંધ 2020 નાં દરોની યુઝર ફી પાછી ખેંચીને ગત વર્ષ 2019 નાં દરો પ્રમાણે કરી. આ ફેરફારો જુલાઈ 1, 2020 થી અમલમાં આવે છે, અને ફેરફારો આ વર્ષના અંત સુધી \$1,021,000 જેટલી રાહત પૂરી પાડશે.

આપણું શહેર રહેવાસીઓને સંખ્યાબંધ કાર્યક્રમો અને સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે, જે પહોંચ સુલભ બનાવે અને નાણાંનું વળતર રળી આપે એમ બંને હોય. યુઝર ફીથી સીટીને મિલકત કરના દર પર ભારણ ઘટાડવાની સાથે સાથે ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ મળતી હોય છે.

આ ફેરફારો માર્ટિન મેડેઈરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલરની આગેવાનીમાં મેયરના રિઓર્પનીંગ એન્ડ રિક્વરી વર્કિંગ ગ્રૂપ દ્વારા જાહેર જનતાની સામેલગીરીથી મળેલા પ્રતિસાદના તાત્કાલિક પરિણામ સ્વરૂપે કરવામાં આવ્યા છે. આજની તારીખ સુધીમાં, 3,900 થી વધારે લોકો અને સમૂહોએ શહેરના [ઓનલાઈન સર્વે](#) અને ચાલુ રહેલી હિતધારકોની બેઠકો મારફતે પોતાના પ્રતિભાવો પૂરા પાડ્યા છે.

આપણાં શહેરનો ઓનલાઈન રિક્વરી અને રિઓર્પનીંગ સર્વે જૂન 14, 2020 સુધી ચાલુ રહેશે, અને રહેવાસીઓ અને ધંધાઓને છેવટે પોતાના રિઓર્પનીંગ માટે શહેરની યોજનાઓ પર પોતાના મંતવ્યો જણાવવા આમંત્રિત કરવામાં આવ્યા છે.

વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/COVID19.

અવતરણો (ક્વોટ્સ):

“સમગ્ર COVID-19 મહામારી દરમિયાન, આપણી કાઉન્સિલે ઓનલાઈન અને ટેલિફોન ટાઉન હોલ્સ મારફતે આપણાં સમુદાયના બધાં સભ્યો સાથે પોતાની સક્રિય સામેલગીરી ચાલુ રાખી છે. અમને લાખો લોકો પાસેથી પ્રાથમિક માહિતી મળી છે કે COVID-19 ને લીધે ભારે નાણાકીય તકલીફો ઊભી થઈ છે અને આ અઠવાડિયાનું પરિણામ આપણી સામૂહિક રિક્વરીને સહાયરૂપ થવામાં અમારી કટિબદ્ધતા દર્શાવે છે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“મેયરનું રિઓર્પનીંગ એન્ડ રિક્વરી વર્કિંગ ગ્રૂપ શરૂ થયું ત્યારથી, અમે આપણાં આગળના માર્ગનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે આપણાં રહેવાસીઓ, ધંધાઓ અને હિતધારક સમૂહો પાસેથી અમને સૌથી મહત્વની બાબતો વિશે સાંભળવા મળ્યું છે. અમે એવી યોજના બનાવવા કટિબદ્ધ છીએ જેને આપણો સમુદાય આકાર આપે અને અમે આ અર્થસભર પ્રતિસાદ સાંભળવાનું અને તેની પર કાર્યવાહી કરવાનું ચાલુ રાખીશું.”

- માર્ટિન મેડેઈરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; લીડ (આગેવાન), મેયરનું રિઓપનીંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ

“આપણાં શહેરે તબક્કાવાર રિઓપનીંગનું આયોજન કર્યું છે ત્યારે, એ નિર્ણાયક બની રહે છે કે આપણો સમુદાય આ મહત્વના સંવાદોમાં સક્રિય રહે અને સહભાગી થવાનું ચાલુ રાખે. હું તમામ રહેવાસીઓને પોતાના મંતવ્યો જણાવવા હાલમાં ચાલુ ઓનલાઈન સર્વેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરું છું અને ખાતરી કરાવું છું કે શહેરના આગામી પગલાઓમાં આપણાં સમુદાયની જરૂરિયાતો શ્રેષ્ઠ પ્રતિબિંબિત થશે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca